

મત્લા પંચક-2

(ગઝલનો પ્રથમ શેર 'મત્લા' કહેવાય છે. પ્રત્યેક કવીના પાંચ મત્લા લીધા છે.)

.1.

બસ, એ વીચારે ગઝલ પણ મને રડાવે છે,
હું એનો કાંઈ નથી, જે ગઝલ લખાવે છે.

આઘાત જીંદગીને, હું બમણો આપવાનો;
ટાળીશ નહીં પીડાને, ઉપરથી ભેટવાનો

કદી હસાવે, કદી રડાવે, કદી બચાવે, કદી ફસાવે,
સમયની જાદુગરી છે કેવી, બધાને બધો સમય બતાવે!

પ્રથમ તો ઘાવ આપીને પછી જે માફી માંગે છે;
સમજવું શું, કે દીધેલી પીડા એ પાછી માંગે છે?

વીચારો તમે, એ પ્રમાણે લખાશે?
ગઝલ છે, ગઝલ આપમેળે લખાશે.

સંદીપ પુજારા: 88496 03904

.2.

ખુદને મળવું ઘણું જરુરી છે
બાકી જે છે બધી મજુરી છે

જ્યારે મળે તું આમ તો જાણે મજા પડે,
વચ્ચે ન આવે 'હું' તો વધારે મજા પડે.

મારી સાથે હું જ્યારથી બેઠો.
ત્યારથી એકલો નથી બેઠો.

કેંક એવા મન ઉપર ડાઘા પડ્યા,
આંખનાં પાણીથી એ ધોવા પડ્યા.

કોઈ છલકાયા કરે, કોઈ ઉલેચાયા કરે;
કેંક એવા હોય જે અંદર વલોવાયા કરે.

મહેશ દાવડકર: 99984 90115

.3.

પ્રથમ રેતી ઉપર દોરી હશે માણસ સમી છાયા,
અલગ બે જાત રાખી બેઉમાં રાખી પછી માયા.

હવાએ શ્વાસ આપીને, આ તનને હાંફતું રાખ્યું,
વીચારોએ દીવસ ને રાત મનને હાંફતું રાખ્યું.

માર્ગ સૌને ક્યાંનો ક્યાં લઈ જાય છે!
જીંદગી તો ત્યાંની ત્યાં રહી જાય છે!

સમય શું છે, સમજવામાં બહુ મોડું કરી નાખ્યું,
હતું સોનું; પરખવામાં બહુ મોડું કરી નાખ્યું.

કાયમ રહે છે મન હજી એની તલાશમાં,
શેની હશે આ આવ-જા હર એક શ્વાસમાં?

મનસુખ નારીયા: 94268 12273

4.

છે સજ્જતા જરુરી, નહીંતર જવાય નહીં;
ઘર ઉંચુ હોય છે કવીનું, એ ભુલાય નહીં.

હો તડકો કે છાંયો કંઈ પણ, સઘળું ઉત્તમ!
જીવવાનું ફાવે તો હર ક્ષણ, સઘળું ઉત્તમ!

મને હું જ્યારે મળું છું ત્યારે હમેશાં એવો વીચાર આવે,
બધાનું જીવન હર્યુભર્યુ હો, કદાચ એવી સવાર આવે.

થવાનું હશે એ થવાનું જ છે,
તમારે કે મારે જવાનું જ છે.

છોડ હવે.. મંદીરે શું દીવો કરવાનો,
માણસ ગબડે તો એને બેઠો કરવાનો.

સુનીલ શાહ: 94268 91670

5.

અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે,
તું ચમચી લઈને ઉભો છે; દરીયો માગવા માટે?

સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ,
ઈંટનું ટોળું મળ્યું તો ભીંત થઈ.

જ્યારથી એ જણ કશાની શોધમાં છે,
ત્યારથી આખું જગત વીરોધમાં છે.

આથમી ચુક્યો છું હું એવું નથી, ઉગ્યો છું એવું પણ નથી;
ટુકડે ટુકડે જીવું છું હું, પણ તુટી ચુક્યો છું એવું પણ નથી.

ઉંઘ ક્યાંથી આવે બાળકનેય બીછાને હવે,
વારતા એકેય આવડતી નથી બાને હવે!

અનીલ ચાવડા: 99256 04613

.6.

દર્દીઓનાં મનમાં અહીં જે ભય ટકેલો હોય છે,
ડોક્ટરોનો એના પર વૈભવ ટકેલો હોય છે.

સજાવટ હોય સુંદર, તે છતાં સુંદર નથી હોતા,
છે કારણ એ જ, કે સઘળાં મકાનો 'ઘર' નથી હોતાં.

નવા કલરવ, નવી મૌસમને જેઓ પોંખતા રહેશે,
બુઢાપામાંય લીલાં પર્ણથી એ શોભતા રહેશે.

તાળીઓથી લઈને તાબોટાય અહીં કુટવા પડ્યા,
જીવવાના નામ પર કંઈ તાયફા કરવા પડ્યા!

ખુલ્લી આંખે જાગવાની એની તૈયારી નથી,
જોયું એને જાણવાની એની તૈયારી નથી.

ગુણવંત ઠક્કર 'ધીરજ' : 98255 67575

.7.

આ નાયમનાયમાંથી આપણે નીકળી જવાનું છે,
પદારથ પાંચમાંથી આપણે નીકળી જવાનું છે.

ક્યારેક થાય ભુલ તો ગુલમોર ચીતરું,
કાયમ તને હું યાદ કરી થોર ચીતરું.

લગાવું શું 'મ'ને હું કાનાથી આગળ?
લખી શું શકે કોઈ આનાથી આગળ!

સવાલો તીર થઈ ખુંચે છે, મારો જીવ લઈ લેશે;
બધા તારા વીશે પુછે છે, મારો જીવ લઈ લેશે.

ક્યાં કહું છું કે દાવ છોડી દો,
ખેલ ખેલો; તણાવ છોડી દો.

ડૉ. મનોજ જોશી 'મન': 98242 28598

.8.

પહેલો અઘરો છું, પછી આસાન છું;
પહાડની ઉંચાઈ પર મેદાન છું.

સપનું ઉડી ગયા પછી બાકીમાં કંઈ નથી;
અડધી પથારી ખાલી છે, અડધીમાં કંઈ નથી.

બધી છે વ્યર્થ તારી કમાલ, છોડી દે;
ન ટહુકે ચીત્રનું પંખી, ખયાલ છોડી દે.

ધરતીથી ઉંડે, આભમાં ઉંચે ગયો હશે,
એમ જ તો કોઈ માનવી પુષ્પીત થતો હશે.

ઉદાસી જોઈ નથી બસ, ઉમંગ જોઈ ગયા;
ન જોયો કોઈએ દરીયો, તરંગ જોઈ ગયા!
પંકજ વખારીયા : 98241 43951

.9.

એક કપ કોફી અને તાજી હવા દે,
કાં મને રાજીખુશીથી તું જવા દે!

કેં અજબ ખેંચાણ લઈને જીવતા'તા,
હાથમાં સૌ પ્રાણ લઈને જીવતા'તા.

બોલવામાં ચાલવામાં ફેર છે,
એટલે તો, આટલું અંધેર છે!

ખુબ ઉંચે સ્થાન હોવી જોઈએ,
લાગણી ધનવાન હોવી જોઈએ.

ડગલે પગલે એટલે વાંધા પડે છે,
સાવ ખોટા માણસો સાચા પડે છે.

દીનેશ કાનાણી : 98242 19096

.10.

મણકો છું, પણ હું માળાની બહાર ઉભો છું,
સાચું કહું તો સરવાળાની બહાર ઉભો છું.

દર્પણનું બીંબ કામ કોઈ આવશે નહીં;
સરનામું પુછશો નહીં, બતાવશે નહીં.

રેતના ઘરમાં રહું છું, રણ નથી;
આંસુમાં દેખાઉં છું, દર્પણ નથી.

શક્યતાને આ રીતે સાંધો નહીં,
ઉંબરા પર ઘર તમે બાંધો નહીં.

કેંક યુગોથી સ્થીર ઉભો છું, રસ્તામાં છું;
હું ક્યાં સાચો પડવાનો છું? સપનામાં છું.

અંકીત ત્રીવેદી : 9913196969

@ @ @ @ @

'સન્ડે ઈ.મહેફીલ'ના આ અંકના અતીથી સમ્પાદકો, સુરતના યુવા ગઝલકારો ભાઈ

શ્રી ગૌરાંગ ઠાકર – (gaurang_charu@yahoo.com) અને

ભાઈ શ્રી સુનીલ શાહ (sunilshah101@gmail.com)નો ખુબ ખુબ આભાર..

..ઉ.મ..

@ @ @ @ @

'સન્ડે ઈ.મહેફીલ' - વર્ષ : પંદરમું - અંક : 448 – March 15, 2020

'ઉંઝાજોડણી'માં : અક્ષરાંકન સુનીલ શાહ - sunilshah101@gmail.com

@ @ @ @ @

Download Earlier SeMs :

<https://www.gujaratilexicon.com/gujarati-literature-ebooks/sundayemahefil/>

@ @ @ @

Have you ever visited :
<http://www.gujaratilexicon.com> ?

More than **3,78,38,000** Gujarati Language lovers have visited
<http://www.gujaratilexicon.com>

More than **1,58,65,000** have visited Digital Bhagwadgomandal
<http://www.bhagwadgomandal.com>

More than **11,15,000** have visited Lokkosh
<http://lokkosh.gujaratilexicon.com>

More than **13,31,000** have visited Global-Gujaratilexicon
<http://global.gujaratilexicon.com>

@ @ @ @ @ @ @ @